

North Zone Community Halls Booking Form

• Fields Are Mandatory

Booking Type*	<input type="checkbox"/> Advance <input type="checkbox"/> Regular		
Hall Name*	<input type="checkbox"/> Utran Community Hall <input type="checkbox"/> EWS Awas H-1 Community Hall <input type="checkbox"/> EWS Awas H-3 Community Hall <input type="checkbox"/> EWS Awas H-5 Community Hall <input type="checkbox"/> Vastadevdi Community Hall & Party Plot <input type="checkbox"/> Bharimata Community Hall <input type="checkbox"/> Singanpore Multipurpose Community Hall		
Program Type*	<input type="checkbox"/> Educational/ Samajik Sanskrutik Karyakram (શૈક્ષણિક/ સામાજીક સાંસ્કૃતિ કાર્યક્રમ)	<input type="checkbox"/> Religious Lectures (ધાર્મિક વચન)	<input type="checkbox"/> Seminars (સેમીનાર)
	<input type="checkbox"/> Marriage/ Reception (લગ્ન / સ્વાગત)	<input type="checkbox"/> Business Purpose (બિઝનેસ હેતુ)	<input type="checkbox"/> Shok Sabha (Without Food & Breakfast) શોક સભા (ફુડ એન્ડ બ્રેક ફાસ્ટ વગર)
	<input type="checkbox"/> Annual Meeting (Without Food & Breakfast) વાર્ષિક મીટીંગ (ફુડ એન્ડ બ્રેક ફાસ્ટ વગર)	<input type="checkbox"/> Registered Working For Public Purposes Public Trusts, Associations (હેતુઓ માટે કામ કરતા રજીસ્ટર્ડ જાહેર ટ્રસ્ટ એસોસિએશનો)	
Booking Date*			
Floor*	<input type="checkbox"/> Ground Floor <input type="checkbox"/> First Floor (If Available)		
Name Of Organization / Applicant*			
	(Cheque For Refund Of Deposit If Any Will Be Issued In Above Name Only)		
Responsible Person*			
Identity Card No.*			
Tan No.			
Gst No.			
Address For Communication*			
City*			
State*			
Email Id*			
Phone No.*			
Mobile Number*			
MICR CODE*			
BANK ACCOUNT NO*			
IFSC CODE*			

Responsible Person
Sig.

Note:

1. For Booking Within 15 Days, The Payment Must Be Mande In Cash Only.
2. Advance Booking To Be Considers As 151 Days Or More And Regular Booking
3. Consider Within 150 Days.

North Zone Utran Party plot Booking Form

• Fields Are Mandatory

Booking Type*	<input type="checkbox"/> Advance <input type="checkbox"/> Regular		
Hall Name*	<input type="checkbox"/> Utran Party plot		
Program Type*	<input type="checkbox"/> Educational Organization Cultural Program(Under SMC) शैक्षणिक संस्थाओ सांस्कृतिक कार्यक्रम(छेठण एसएमसी)	<input type="checkbox"/> Organization or person for other purposes अन्य हेतुओ माटे काम करती संस्था /व्यक्ति /	
Booking Date*			
Floor*	<input type="checkbox"/> Ground Floor <input type="checkbox"/> First Floor(If Available)		
Name Of Organization / Applicant*			
	(Cheque For Refund Of Deposit If Any Will Be Issued In Above Name Only)		
Responsible Person*			
Identity Card No.*			
Tan No.			
Gst No.			
Address For Communication*			
City*			
State*			
Email Id*			
Phone No.*			
Mobile Number*			
Micr Code*			
Bank Account No*			
Ifsc Code*			

**Responsible Person
Sig.**

Note:

1. For Booking Within 15 Days, The Payment Must Be Made In Cash Only.
2. Advance Booking To Be Considers As 151 Days Or More And Regular Booking
3. Consider Within 150 Days.